

ત્વરિત જાહેરાત માટે

મે 29 થી જુન 4 સુધીના સમયગાળાને સિટી એક્સેસિબિલ સ્પોર્ટ્સ વીક (દિવ્યાંગ રમતગમત સપ્તાહ) તરીકે સ્વીકારે છે

બ્રમ્પટન, ઓન્ટારિયો (17 મે 2022) – સિટી ઓફ બ્રમ્પટનના રિક્રિએશન વિભાગ સિટીની એક્સેસિબિલિટી ટીમના સહયોગમાં બ્રમ્પટન ખાતે મે 29 થી જુન 4 સુધી નેશનલ એક્સેસિબિલિટી વીક દરમિયાન એક્સેસિબલ સ્પોર્ટ્સ વીક (દિવ્યાંગ રમતગમત સપ્તાહ)નું આયોજન કરશે.

બ્રમ્પટનમાં એક્સેસિબલ સ્પોર્ટ્સ વીક (દિવ્યાંગ રમતગમત સપ્તાહ) અનુકૂળ કરેલ રમતગમત, સિટીની વિવિધ સવલતો, પ્રોગ્રામ્સ અને સેવાઓની રજૂઆત કરશે. સિટી આખા વર્ષ દરમિયાન સહભાગી થવા સામેના અંતરાયો દૂર કરવા ઝડૂમે છે જેથી સુનિશ્ચિત કરી શકાય કે તમામ નિવાસીઓને રિક્રિએશન સેવાઓનો લાભ મળતો રહે જેમાં રમતગમત અને ફિટનેસ પ્રોગ્રામ્સની બહોળી શ્રેણીનો સમાવેશ થાય છે.

એવિન્ટ્સમાં આખા સપ્તાહ દરમિયાન સામેલ હશે વિવિધ અજમાવી-જુઓ રમતગમત, જેમાં સમાવેશ થાય છે વ્હીલચેર બાસ્કેટબોલ, સિટિંગ વોલિબોલ, સ્લેજ હોકી અને બીજું ઘણું બધું. જુન 4ના રોજ શનિવારે સેવ મેક્સ સ્પોર્ટ્સ સેન્ટર ખાતે બપોરે 1 થી 5 સુધી એક્સેસિબિલિટી ફેર અને મલ્ટિ-સ્પોર્ટ્સ શોકેસ યોજાશે. નોંધણી આવશ્યક નથી. તમામ ઈવેન્ટ્સ નિ:શુલ્ક, ડ્રોપ-ઇન પ્રોગ્રામ્સ છે.

નેશનલ એક્સેસિબિલિટી વીક ઉજવવા માટે એક ઈન્ક્લુઝન ડીનર અને ડાન્સ શુક્રવારે, જુન 3ના રોજ લોફર્સ લેક રિક્રિએશન સેન્ટર (Loafer's Lake Recreation Centre) ખાતે સાંજે 6:30 થી 10:30 સુધી યોજાશે. નોંધણી આવશ્યક છે.

[એક્સેસિબલ સ્પોર્ટ્સ વીક \(દિવ્યાંગ રમતગમત સપ્તાહ\) ઈવેન્ટ્સ વિશે વધુ જાણકારી માટે અહીં ક્લિક કરો.](#)

સિટીના બહુવર્ષિય એક્સેસિબિલિટી પ્લાન અંગે તમારો અભિપ્રાય આપો

સિટી ઓફ બ્રમ્પટનના 2022 થી 2026 માટેના બહુવર્ષિય એક્સેસિબિલિટી પ્લાન (MAP) માં સિટી દિવ્યાંગતા અંગેના અંતરાયો કેવી રીતે ઘટાડશે, નિવારણ કરશે અને દૂર કરતા રહેશે અને અમારા પ્રોગ્રામ્સની, સેવાઓની અને સવલતોની સુલભતા કેવી રીતે વધારશે તેની યોજના છે.

MAP તે કાર્યોને રેખાંકિત કરે છે જેમાં અમે કેવી રીતે વ્યવસાયોને પ્રવૃત્ત કરીએ છીએ, અમારા પાયામાં બળનો સંચાર કરીએ છીએ અને કેવી રીતે સંસ્કૃતિઓના પરિવર્તનને પ્રોત્સાહિત કરીએ છીએ જેનાથી બ્રમ્પટનના તમામ નાગરિકો રોજિંદી પ્રવૃત્તિઓમાં સહભાગી થઈ શકશે જેમકે કામકાજ કરવું; જાહેર પરિવહનનો ઉપયોગ કરવો; ઓનલાઇન સેવાઓનો લાભ લેવો; રમતગમત અને સાંસ્કૃતિક ઇવેન્ટ્સમાં હાજરી આપવી; અને રિક્રિએશન સવલતો, પાર્ક્સ અને અન્ય જાહેર જગ્યાઓને માણવી.

સિટી હાલમાં MAPના મુસદ્દા પર પ્રતિભાવ આવે તેમ ઇચ્છે છે. [એક ટૂંકા સર્વેક્ષણમાં તમારા વિચારો પ્રદાન કરવા અહીં ક્લિક કરો.](#)

સુવાક્ષો

"હું તમામ લોકોને નેશનલ એક્સેસિબિલિટી વીક (રાષ્ટ્રીય દિવ્યાંગ સપ્તાહ) અને એક્સેસિબલ સ્પોર્ટ્સ વીક (દિવ્યાંગ રમતગમત સપ્તાહ)નો સ્વીકાર કરવા માટે અમારી સાથે જોડાઈ જવા પ્રોત્સાહિત કરું છું જે બ્રમ્પટનમાં મે 29 થી જુન 4 સુધી હશે. બ્રમ્પટન એક સ્વાસ્થ્યપ્રદ અને સુરક્ષિત શહેર છે, જ્યાં તમામ નિવાસીઓને પોતાની સુખાકારી માટે રિક્રિએશન સેવાઓ સુલભ છે."

- પૅટ્રિક બ્રાઉન, મેયર, સીટી ઓફ બ્રમ્પટન

સિટી ઓફ બ્રમ્પટનના 2022 થી 2026 માટેનો બહુવર્ષિય એક્સેસિબિલિટી પ્લાન અમારા પ્રોગ્રામ્સ અને પહેલોને વધુ સુલભ બનાવવા માટે સહાય કરશે જેમકે એક્સેસિબલ સ્પોર્ટ્સ વીક (દિવ્યાંગ રમતગમત સપ્તાહ), અને બ્રમ્પટનની સેવાઓ અને સવલતો. થોડો સમય આપીને યોજનાના મુસદ્દા અંગે આપના વિચારો જરૂરથી રજૂ કરશો જેથી આપણા શહેરનો વિકાસ થઈ શકે - તમામ લોકો માટે.

- રોવેના સાન્તોસ, રીજનલ કાઉન્સિલર, વોર્ડ 1 અને 5; પ્રમુખ, કમ્યુનિટી સર્વિસિસ, સિટી ઓફ બ્રમ્પટનના પ્રમુખ

"આ એક્સેસિબલ સ્પોર્ટ્સ વીક (દિવ્યાંગ રમતગમત સપ્તાહ)માં બ્રમ્પટનવાસીઓ પોત પોતાની જરૂરિયાત અનુસાર રમતગમત અને ફિટનેસ પ્રોગ્રામિંગની બહોળી શ્રેણી માટે નોંધણી કરાવી શકશે. અમે સહભાગ લેવાના અંતરાયો દૂર કરવા માટે અનુકૂળ કરેલ રમતગમત યોજી રહ્યા છીએ જેથી બધાં લોકો નિરોગી અને સક્રિય રહી શકે.

- પૅટ ફોર્ટિની, રીજનલ કાઉન્સિલર, વોર્ડ 7 & 8, એક્સેસિબિલિટી એડવાઈઝરી કમિટી કાઉન્સિલ સભ્ય, સિટી ઓફ બ્રમ્પટન,; સભ્ય, રિજન ઓફ પીલ એક્સેસિબિલિટી એડવાઈઝરી કમિટી

"સિટીના કર્મચારીઓ સમાવેશીત રિક્રિએશન પ્રોગ્રામિંગ પ્રદાન કરવા માટે સમર્પિત છે. એક્સેસિબલ સ્પોર્ટ્સ વીક (દિવ્યાંગ રમતગમત સપ્તાહ)ને ઇવેન્ટ્સમાં હાજર રહી ઉજવો અને બ્રમ્પટનના નવા બહુવર્ષિય એક્સેસિબિલિટી પ્લાન વિશે તમારા અભિપ્રાયો આપો.

- પૉલ મોરિસન (Paul Morrison), ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, સિટી ઓફ બ્રમ્પટન

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રમ્પટનમાં 7,00,000 લોકો વસે છે અને તેમાં 75,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. વધુ જાણવા માટે www.brampton.ca

મિડિયા સંપર્ક (MEDIA CONTACT):

સીટી ઓફ બ્રમ્પટન મલ્ટિકલ્ચરલ મિડિયા

multiculturalmedia@brampton.ca